



SEC/0102/2022

By E-Filing

1st February, 2022

National Stock Exchange of India Ltd. "Exchange Plaza", C-1, Block G, Bandra- Kurla Complex, Bandra (E), <u>Mumbai – 400 051.</u>	BSE Ltd. Corporate Relationship Department, 27 th Floor, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, <u>Mumbai - 400 001.</u>
Scrip Symbol : APARINDS	Scrip Code : 532259
<u>Kind Attn.: The Manager, Listing Dept.</u>	<u>Kind Attn.: Corporate Relationship Dept.</u>

Subject: Publication of Extract of Un-audited Financial Results for the 3rd Quarter and Nine-Months ended 31st December, 2021 in Newspapers.

Ref : Regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time.

Dear Sir(s) / Madam,

We refer to our Letter No. SEC/3101/2022 dated 31st January, 2022 vide which we have submitted the Standalone and Consolidated Un-audited Financial Results of the Company for the Third Quarter and Nine Months ended 31st December, 2021 (2021-22). We are now submitting herewith copies of the Extract of Un-audited Financial Results of the Company for the Third Quarter and Nine Months ended 31st December, 2021, on Consolidated basis, published in Business Standard, English language newspaper (having Nationwide Circulation) and Vadodara Samachar (Regional language newspaper) at Vadodara, Gujarat on 1st February, 2022.

The above information is also available on the Company's website at www.apar.com.

Kindly take the above information on your record.

Thanking you,

Yours Faithfully,
For APAR Industries Limited

Harishkumar Malsatter
(Deputy Manager- Secretarial)

Encl.: As above

APAR Industries Limited
Regd Office: 301/306, Panorama Complex, RC Dutt Road, Alkapuri, Vadodara - 390007, India
+91 265 6178 700/6178 709 apar.baroda@apar.com www.apar.com

Corporate Office: APAR House, Corporate Park, V N Purav Marg, Chembur, Mumbai 400 071, India
+91 22 2526 3400/6780 0400 corporate@apar.com www.apar.com CIN: L91110GJ1989PLC012802

Circle SASTRA Centre - 1st Floor, Meghani Tower, Station Road, Surat, Gujarat-3 Ph. : 0261-2454543 email: cs8323@pnb.co.in
APPENDIX IV [See Rule 8 (i)] POSSESSION NOTICE (For immovable property)

Whereas, the undersigned being the Authorised Officer of the Punjab National Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Ordinance, 2002 (Ord. 3 of 2002) and in exercise of Powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 24.05.2021 calling upon the borrowers/mortgagor Mr. Kalpeshbhai Rattal Parmar S/O Rattal Dulabhai Parmar and Mr. Gautam Rattal Parmar (Borrower) and Mr. Bhupathai Dulabhai Parmar (Guarantor), to repay the amount mentioned in the notice being Rs. 13,24,562.00 (Rupees Thirteen Lac Twenty Four Thousand Five Hundred Sixty Two Only) as on 30/04/2021 and further interest with monthly rest and other charges and expenses within 60 days from the date of notice/date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 25th day of January of the year 2022.

The Borrowers/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Punjab National Bank for an aggregate amount of Rs. 13,24,562.00 (Rupees Thirteen Lac Twenty Four Thousand Five Hundred Sixty Two Only) as on 30/04/2021 as on 12/08/2021 and further interest thereon.

The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured asset.

Description of Immovable Property(s)

All the Right and Interest in the Property Bearing Plot No: 88 Admeasuring 44.65 sq. mtrs. (after resurvey Block No. 3100 admeasuring 45.00 sq. mtrs.) Undivided Share of Road Rasta & C.O.P. Admeasuring 22.74 Sq. mtrs. of KRISHNA RESIDENCY VIBHAG-2 Situated Revenue Survey No. 261, 263, Block No. 278 at moje Mankana, Sub Dist. Kamrej, Dist. Surat (Mr. Kalpeshbhai Rattal Parmar S/O Rattal Dulabhai Parmar and Mr. Gautam Rattal Parmar) Bounded: North: Plot No: 87, East: Society Road, South: Plot No: 89, West: COP

Date : 25/01/2022 Place : Surat Rajesh Goel, Authorised Officer, Punjab National Bank

Bank of Baroda

E AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES (under Provision to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules)

E- Auction Sale notice for sale of immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest, 2002 read with provision to Rule 8(6) of the Security (Enforcement) Rules 2002. Notice is hereby given to the public in general and in particular to the borrower and guarantor that the below described immovable property mortgaged to the secured creditor, the Physical Possession of property has been taken by the Authorised Officer of Bank of Baroda Secured creditor will be sold on "As is where is" "As is what is" and "Whatever there is" on 17.02.2022, for recovery of Amount as under, with further interest at contractual rates and rests, charges etc, due to Bank of Baroda, secured creditors.

E-Auction Date & Time: 17.02.2022 between 11.30 am to 03.30 pm
with auto extension of 20 minutes each till sale is completed

Sr. No.	Branch	Name of the Borrower/Guarantor	Description of Properties	Reserve Price	Due Amount
				EMD Amount	
01	Karjan	Borrowers: Mr. Umeshbhai Manubhai Patel & Mrs. Nimishaben Umeshbhai Patel	Plot No. D-26, Shreem Samrudhi, Opp. Rajput Wadi, Near Sanskar Park, Prayosha Chowkadi Highway Road, Karjan, Vadodara. Total Built Up Area: 838 Sq.Ft., R.S. No. 987, Village & Taluka: Karjan, Dist: Vadodara. Boundary: East: Plot No. 27, West: Plot No. 25, North: Plot No. 23, South: 7.5 Mt. Society Road.	Rs. 21,00,000/- Rs. 2,10,000/-	As on 31.01.2022, Rs. 25,40,000/- payable together with further interest at contractual rates and rests along with costs, charges etc.

Property Inspection for Timing : 05.02.2022 to 16.02.2022 from 10.00 am to 5.00 pm
For further details, Contact: Mr. A. K. Thakur. Mob: 9687689166

This may be treated as a Notice under Rule 8(6) of the Security (Enforcement) Rules 2002 to the borrowers/ and guarantors of the said loan about holding of a auction on the above mentioned date.

Place: Karjan (Baroda), Date: 31.01.2022 Authorised Officer - Bank of Baroda

Edelweiss HOUSING FINANCE LTD.

Registered Office: Situated at Edelweiss House, Off. C. S. T. Road, Kalina, Mumbai - 400 098
 Regional Office Address: Office 301,302,303,304, 3rd Floor 3rd Eye Vision Opposite Shivalki Plaza, Near IIM, Panjira Pol Ahmedabad -380009

DEMAND NOTICE UNDER SECTION 13(2) OF THE SARFAESI ACT, 2002

Notice is hereby given that the following borrower/s have defaulted in the repayment of principal & interest of the loan facilities obtained by them from the EHLF and the said loan accounts have been classified as Non-Performing Assets(NPA). The Demand Notice was issued to them under Section 13(2) of the Securitisation and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act 2002(SARFAESI Act) on their last known address. In addition to said demand notice, they have been informed by way of this public notice.

Details of the Borrowers, Securities, Outstanding Dues, Demand Notice sent under Section 13(2) and Amount claimed there under are given as under:

1.Name and Address of the Borrower, Co Borrower/Guarantor Loan Account No. And Loan Amount:
 Shubhankumar Prasad (Borrower) And Singhansan Prasad And (Co-Borrower) Vidhyavandevi Singhansan Prasad (Co-Borrower) All Residing At: Tenament No 185 Shiv Shakti Nagar 2 Bhd Makarpura Bus Depo Makarpura Road Makarpura Vadodara 390010 And At: Flat No A2/103 Nilkanth Residency Behind Shaligram Residency Near Air Force Station Makarpura, Vadodara 390010
 Loan Account: LVDRS0000033317. Loan Agreement Date: 27-Nov-2017 Demand Notice Date: 12.01.2022
 Loan Amount: Rs. 1231554/- (Rupees Twelve Lac Thirty One Thousand Five Hundred Fifty Four Only)
 Amount Due: Rs. 9,76,193.03/- (Rupees Nine Lakh Seve Six Thousand One Hundred Ninety Three And Three Paise Only)

Details of the Secured Asset: All That Part And Parcel Of Non Agricultural Plot Of Land In Moje: Makarpura, Vadodara Lying Being And Situated On The Land Bearing R.S.No.240, C.S.No. 691, Admeasuring 4148 Sq Mtrs. Pakli Admeasuring 280.53 Sq Mts, Road Deduction Admeasuring 3867.47 Sq Mts, Known As "Nilkanth Residency" Tower -A (Wing A-2), First Floor, Flat No. 103 Construction Admeasuring 41.35 Sq Mtrs. Undivided Share Of Land Admeasuring 21.99 Sq Mtrs At Registration District & Sub District Vadodara District Vadodara Bounded As Sale Deed: North: Flat No. A-2/104, South: Flat No. A-1/104, East: Common Lift, West: Ots.

2.Name and Address of the Borrower, Co Borrower/Guarantor Loan Account No. And Loan Amount:
 Laljibhai Dhirubhai Chodvadiya (Borrower) And Glatben Laljibhai Sodvadiya And Prakash Laljibhai Sodvadiya (Co-Borrower) All Residing At: 123, Shiv Shakti Society-1, Kargil Chowk, Puna Gam, Surat 395010
 And At: Plot No.74, Shaligram Row House, Nr.Wisdom International School, Canal Road, Kamrej, Surat 394180
 Loan Account: LSRU0000084520 and LSRU0000084522. Loan Agreement Date: 24-Oct-2020 And 30-Oct-2020
 Loan Amount : Rs. 1974000/- (Rupees Nineteen Lac Seventy Four Thousand Only) And Rs. 4120000/- (Rupees Nineteen Lac Seventy Four Thousand Only) Demand Notice Date : 12.01.2022
 Amount Due : Rs. 2001721.73/- (Rupees Twenty Lakh One Thousand Seven Hundred Twenty One And Seventy Three Paise) And Rs. 424937.38/- (Rupees Four Lakh Twenty Four Thousand Nine Hundred Thirty Seven And Eighty Eight Paise Only)

Details of the Secured Asset: All That Part And Parcel Of Property Bearing Plot No 74 Admeasuring 76 Sq Yards I.E. 63.54 Sq Mts (As Per Kip Block No. 562/74 Admeasuring 59.26 Sq Mts), Along With 33.18 Sq Mts Undivided Share In The Land Of Road & Cop In "Shaligram Row House", Situated At Revenue Survey No. 616, 618 Block No. 562 Admeasuring He. 0-95-13 Sq Mts Of Moje Kamrej, Ta:Kamrej, Dist: Surat Bounded As Sale Deed:- North: Plot No. 73, South : Society Internal Road, East : Plot No.75, West : Society Internal Road.

You the above Borrower/S are therefore called upon to make payment of the outstanding dues as mentioned hereinabove in full within 60 days of this Notice failing which the undersigned shall be constrained to take action under the SARFAE-SI act to enforce the above mentioned securities. Please note that as per Section 13(13) of The Said Act, You are restrained from transferring the above-referred securities by way of sale, lease or otherwise without our consent.

Place: Gujarat Date: 01.02.2022 Sd/- Authorised Officer For Edelweiss Housing Finance Limited

CFM Asset Reconstruction Pvt. Ltd.

Registered Office : A3, 5th Floor, Safal Profitaire, Near Prahlad Nagar Garden, Ahmedabad -380015.
Corporate Office : CFM Asset Reconstruction Pvt. Ltd., 1st Floor, Wakefield House, Sprout Road, Ballard Estate, Mumbai - 400038.
 Phone : +91 22 40055280/40055282

APPENDIX-IV POSSESSION NOTICE (Rule-8(1)) (For immovable property)

Whereas, The Authorised Officer of The Mehsana Urban Co-operative Bank Ltd., under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest [Act], 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12), 13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated 16-10-2018 calling upon the Borrower/partners of borrower firm/Guarantors (1) M/s Vandan Construction Company (Borrower/Mortgagor) (2) Mr. Pranavkumar Manilal Patel (Partner of the Borrower firm) (3) Mr. Manubhai Babaldas Patel (Partner of the Borrower firm) (4) Mr. Ashishkumar Tribhovandas Patil (Guarantor) and (5) Mr. Nigamkumar Babulal Patel (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 1,86,11,571/- (Rupees One Crore Eighty Six Lakh Eleven Thousand Five Hundred Seventy One Only) as on 30-09-2018 plus further interest together with costs, charges and expenses incurred, thereon within 60 days from the date of receipt of the said notice.

Further, The Mehsana Urban Co-operative Bank Ltd., has assigned all its rights, title and interest of the entire outstanding debt of above loan account along with underlying securities in favour of CFM Asset Reconstruction Private Limited vide an Assignment Agreement dated 26-03-2021 entered between The Mehsana Urban Co-operative Bank Ltd. and CFM Asset Reconstruction Private Limited under the provisions of Section 5 of SARFAESI Act 2002.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of Act read with rule 8 of the security interest Enforcement Rules 2002 on this 28th day of JANUARY of the year 2022.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the CFM Asset Reconstruction Private Limited for an amount Rs. 1,86,11,571/- (Rupees One Crore Eighty Six Lakh Eleven Thousand Five Hundred Seventy One Only) due as on 30-09-2018 and interest there on w.e.f. 01-10-2018 plus other charges. (Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has been given effect)

Please note that the public notice dated 07-03-2019 issued and published in newspaper on 10-03-2019 in 'Gujarat Samachar' & 'Divya Bhaskar' on 09-03-2019 is hereby withdrawn and present notice has superseded all other earlier notices issued under section 13(4) of the SARFAESI Act, 2002 by the Assignor/Secured creditor/Assignee. "The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All the piece and Parcel of Commercial property Revenue Survey NO 1990/50, N.A. land City Survey No 910,911,912,913,914,015,1173,1174,1175 Combine New Survey No. 910 Sheet No. 165, N.A. PLOT NO 1 TO 81, As per sanctioned layout plan Construction Area 2357.05 Sq. Mtrs. Plus Open common Plot, Parking Road with Margin of Open Plot area adm. 5015.95 Sq. Mtrs i.e. Total Land adm. 7373.00 Sq. Mtrs constructed on N.A. land and open land without construction namely "SINGAPUR HUB", Malgondow Road, MEHSANA, Sub Register Mehsana, District: Sub District Mehsana under Mehsana Nagarपालिका boundary in the name of M/s. Vandan Construction Company.

Authorised Officer
Date : 28-01-2022 CFM Asset Reconstruction Private Limited
Place : Mehsana (Acting in its capacity as Trustee of CFMARC Trust - 1 MUCB)

APAR

APAR INDUSTRIES LIMITED

(CIN : L91110G1989PLC012802)
 Registered Office : 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodara - 390 007 (Gujarat), India.
 Tel. No. : (0265) 2339906 Fax : (0265) 2330309 E-mail : com.sec@apar.com URL : www.apar.com

EXTRACT OF UN-AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER AND NINE MONTHS ENDED 31st DECEMBER, 2021

₹ in crore

Particulars	Consolidated		
	Quarter ended	Nine Months ended	Quarter ended
	31st Dec., 2021	31st Dec., 2021	31st Dec., 2020
	(Reviewed)	(Reviewed)	(Reviewed)
Total Income from operations (Gross)	2,228.83	6,307.54	1,713.98
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	73.87	230.05	105.73
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	73.87	230.05	105.73
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	54.90	174.07	82.45
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	69.95	228.77	69.95
Equity Share Capital	38.27	38.27	38.27
Earnings Per Share (Face Value of ₹ 10/- each) (for continuing and discontinued operations)			
Basic and Diluted	14.36	45.49	21.55

Notes :

1) The said Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Meeting held on 31st January, 2022.

2) **Additional information on Standalone financial results is as follows :**

Particulars	₹ in crore		
	Quarter ended	Nine Months ended	Quarter ended
	31st Dec., 2021	31st Dec., 2021	31st Dec., 2020
	(Reviewed)	(Reviewed)	(Reviewed)
Total Income from operations (Gross)	2,071.31	5,775.04	1,583.91
Profit before tax	70.70	211.73	89.46
Profit for the period	52.87	157.54	66.73
Total Comprehensive income (after tax)	67.96	210.74	54.38

3) The above is an extract of the detailed format of Statement of standalone and consolidated financial results filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Statement of standalone and consolidated financial results are available on the Stock Exchange websites www.bseindia.com (Scrip Code 532259) and www.nseindia.com (Scrip Symbol - APARINDS) and on Company's website www.apar.com.

For APAR Industries Limited
 Sd/-
 Kushal N. Desai
 Chairman & Managing Director
 DIN : 0008084

Place : Mumbai
Date : 31st January, 2022

Circle SASTRA Centre, Surat 1st Floor, Meghani Tower, Station Road, Surat - 395 003. Ph. : 0261-2454543
 E-Mail : cs8323@pnb.co.in

Appendix-IV [See Rule 8(i)] Physical Possession Notice (For Immovable Property)

Whereas, The undersigned being the Authorised Officer of Punjab National Bank, SASTRA Centre, Surat under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 20/11/2021 under section 13(2) of the said Act calling upon the Borrowers M/s. Shree Sai Rubber Products – Proprietor Shri Pankaj Kamleshankar Rai to repay the amount mentioned in the notice being Rs.39,43,454.24 (Rupees Thirty Nine Lac Forty Three Thousand Four Hundred Fifty Four & Paise Twenty Four Only) as on 31/10/2021 with further interest at the contracted rate and cost expenses etc., within 60 days from the date of the receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of power conferred on him under section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on 28th day of January 2022.

The borrowers in particular, guarantor and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Punjab National Bank for an amount of Rs.39,43,454.24 (Rupees Thirty Nine Lac Forty Three Thousand Four Hundred Fifty Four & Paise Twenty Four Only) as on 31/10/2021 with further interest at the contracted rate and cost expenses etc., until payment in full.

The borrower's attention is invited to provision of Sub Section (8) of the Section 13 of the Act in respect of **DESCRIPTION OF IMMOVABLE PROPERTY**

All that piece and parcel of NA land bearing plot no. 45 admeasuring 500 sq. mtrs bearing computerised survey no. 8/2 pakee 55, bearing new survey no. 2030 after promulgation NA land bearing plot no. 46 admeasuring 500 sq. mtrs bearing computerised survey no. 8/2 pakee 56 bearing new survey no. 2025 after promulgation, NA land bearing plot no. 47 admeasuring 500 sq. mtrs bearing computerised survey no. 8/2 pakee 57 bearing new survey no. 2028 after promulgation & NA land bearing plot no. 48 admeasuring 500 sq. mtrs bearing computerised survey no. 8/2 pakee 58/pakee 1, bearing new survey no. 2028 after promulgation situated at V.I. Sarigam, Tal. Umbergaon, Dist. Valsad, Owned by Mr.Pankaj Kamleshankar Rai.

Rajesh Goel, Authorised Officer
Date : 28/01/2022 | Place : Umbergaon
Punjab National Bank

Circle SASTRA Centre - 1st Floor, Meghani Tower, Station Road, Surat, Gujarat-3 Ph. : 0261-2454543 email: cs8323@pnb.co.in
APPENDIX IV [See Rule 8 (i)] POSSESSION NOTICE (For immovable property)

Whereas, the undersigned being the Authorised Officer of the Punjab National Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Ordinance, 2002 (Ord. 3 of 2002) and in exercise of Powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 24.05.2021 calling upon the borrowers/mortgagor Mr. Bharatbhai Anandbhai Nakum S/O Mr. Anandbhai Nakum Mrs. Manjulaben Bharatbhai Nakum (Borrower) and Mr. Rajubhai Devayathai Vaniya S/O Dhudhabhai Vaniya (Guarantor), to repay the amount mentioned in the notice being Rs. 14,00,236.23 (Rupees Fourteen Lac Two Hundred Thirty Six Paise Twenty Three Only) as on 30/04/2021 and further interest with monthly rest and other charges and expenses within 60 days from the date of notice/date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 25th day of January of the year 2022.

The Borrowers/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Punjab National Bank for an aggregate amount of Rs. 14,00,236.23 (Rupees Fourteen Lac Two Hundred Thirty Six Paise Twenty Three Only) as on 30/04/2021 and further interest thereon.

The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured asset.

Description of Immovable Property(s)

All the Right and Interest in the Property Bearing Plot no: 35 Admeasuring 44.65 sq. mtrs. i.e. 53.33 sq yards (after resurvey Block No. 3058 adms 45.00 sq. mtrs.) Undivided Share of Road Rasta & C.O.P. Admeasuring 22.74 Sq. mtrs. of KRISHNA RESIDENCY VIBHAG-2 Situated Revenue Survey No. 261,263, Block No. 278 adm. Hecor-1-60-54 aare, at moje Mankana, Sub Dist. Kamrej, Dist. Surat (Mr. Bharatbhai Anandbhai Nakum S/O Mr. Anandbhai Nakum Mrs. Manjulaben Bharatbhai Nakum) Bounded: North : Plot No: 36, East: Adj. Plot, South: Plot No: 34, West: Society Road.

Date : 25/01/2022 Place : Surat Rajesh Goel, Authorised Officer, Punjab National Bank

सेन्ट्रल बँक होम फायनेन्स लिमिटेड
Cent Bank Home Finance Limited

Registered Office : Bhopal Corporate Office : Mumbai
 सेन्ट्रल बँक ऑफ हॉमिन्स फायनेन्स लिमिटेड Subsidiary of Central Bank of India

Branch Surat - 3rd floor, Siddhi Shopping Centre, Above Bank of Maharashtra, Citylight Road, Surat- 395007 Ph. No. 0261-2254510-11, Mob: 09988988625

APPENDIX – IV-A [Rule 8(6)] TENDER CUM AUCTION SALE NOTICE

Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the general public and in particular to the Borrowers and Guarantors that the above described immovable property mortgaged / charged to the Secured Creditor, the possession of which has been taken by Authorised Officer of Cent Bank Home Finance Limited Secured Creditor, will be sold on "As is where is" "As is what is" and "Whatever there is Basis" for recovery of amount mentioned against property due to the secured creditor from the borrower. The reserve price and earnest money deposit, description of the immovable property are as mentioned in the table given above.

S No.	Name of the Borrower, Guarantor & File No.	Details of the Properties	Amount Outstanding as on date of demand Notice (Rs.)	Date of Demand Notice Date of Possession	Reserve Price (Rs.) Auction Date	Earnest Money Deposit (Rs.) 10%
01.	Mr. Pratikumar Laljibhai Meghani & Mrs. Khushaliben Pratikumar Meghani Loan A/C No. 01503010000064	All the piece and parcel of immovable property situated at Flat No. A/502, area admeasuring, Admeasuring 1991.15 Sq. Feet i.e. 185.80 Sq. Meter, Super Built Up Area - 1258.73 Sq. Feet, i.e. 116.982 Sq. Meter Built Up Area and as per rules of Real Estate Regulation Act - 2016, 71.73 Sq. Meter Carpet Area, along with undivided proportionate share in land on 5th floor known as "Shreenathji Residency Building No. A" constructed on Non Agricultural land bearing R.S.No. 1319 (western side), its Block No. 1258/A, T.P. Scheme No. 66 (Kosad - Variyav), Original Plot No. 393, Final Plot No. 393 situated at Moje: Variyav, Taluka: Adajan, District: Surat, Boundaries: East : Passage, Stairs & Lift, West:OTS, North:OTS, South : Open Terrace, Owner : Mr. Pratikumar Laljibhai Meghani	₹ 33,97,674/- Plus interest and other charges	05.03.2019 08.07.2021 (Physical)	₹ 28,78,000/- 16.02.2022	₹ 2,87,800/-
02.	Mr. Dharmendra Jagdishbhai Padmani & Mrs. Shobhnaben Dharmendrabhai Padmani Loan A/C No. 01502320000236	Plot No. 148, Jolva Residency constructed on non agricultural land bearing R.S. No. 182, Block No. 223 situated at Moje village : Jolva, Tal.: Palsana, Dist - Surat, Area admeasuring Land Area 48 Sq. Yds. Construction Area 397 Sq. Fts. Boundaries: East - Society Road, West - Plot No. 121, North - Plot No. 147, South - Plot No. 149.	₹ 10,23,311/- Plus interest and other charges	29.07.2019 23.01.2020 (Physical)	₹ 7,27,000/- 16.02.2022	₹ 72,700/-
03.	Mr. Yagnikumar Pravinbhai Sakhawala & Mr. Pravinbhai Lunabhai Sakhawala, Loan A/C No. 01502320000216	Plot No. 152, Jolva Residency constructed on non Agriculture land bearing R.S.No. 182, Block No. 223 situated at Moje village: Jolva, Tal.: Palsana, Dist.: Surat, area admeasuring Land Area 48 Sq. Yds. Construction Area 397 Sq. Fts., Boundaries : East - Plot No. 181, West - Society Road, North - Plot No. 153, South - Plot No. 151.	₹ 10,25,099/- Plus interest and other charges	29.07.2019 23.01.2020 (Physical)	₹ 7,27,000/- 16.02.2022	₹ 72,700/-
04.	All Legal Heirs of Late Jayantilal Goghanbhai Pansara & Mrs. Madhuben Jayantilal Pansara, Loan A/C No.01502320000230	Plot No. 147, Jolva Residency Constructed on non - Agricultural land bearing R.S. No. 182, Block no. 223 situated at Moje Village: Jolva, Tal.: Palsana, Dist.: Surat, area admeasuring Land Area 48 Sq. Yds. Construction Area 397 Sq. Fts. Boundaries: East - Society Road, West - Plot No. 122, North - Plot No. 146, South - Plot No. 148.	₹ 12,34,463/- Plus interest and other charges	08.01.2019 23.01.2020 (Physical)	₹ 7,27,000/- 16.02.2022	₹ 72,700/-
05.	Mr. Gaurangbhai Mansukhbhai Sutaraiya and Mr. Mansukhbhai Mr. Sutaraiya Loan A/C No.01502320000092	All the part and parcel of the property Consisting Plot No. 185, HRP Bungalows, Opp. Royal Park Residency, Kamrej Canal Road, Kamrej, R.S. No. 246/1, 247, Block No. 242/A, 242/B, 242/C, New Block No. 242, Mouje: Kamrej, District Surat, Area : Area: 830 Sq. Ft., Boundaries: East : Adj. Plot No. 186, West : Plot No. 184 , North : Society Internal Road , South : Adj. Property, Owner: Mr. Gaurangbhai Mansukhbhai Sutaraiya	₹ 26,48,744/- Plus interest and other charges	14.09.2017 05.02.2021 (Physical)	₹ 14,25,600/- 16.02.2022	₹ 1,42,560/-

TERMS & CONDITIONS: - (1) The Auction is being held on "As is where is" "As is what is" and "Whatever there is Basis". (2) The secured asset will not be sold below the Reserve Price. (3) The intending purchaser/bidder should submit their bids in the prescribed tender form in a closed envelope separately for each property, with the Earnest Money Deposit (EMD) amount (not below the 10% of Reserve Price) by means of (Demand Draft Nationalised Bank / RTGS / ONLINE Transfer) drawn in favour of Cent Bank Home Finance Ltd. payable at Surat on or before 16.02.2022 up to 4.00 PM at above address of Cent Bank Home Finance Ltd. Surat Branch. (4) The sealed envelope will be opened by the Authorised Officer at Surat Branch in the presence of eligible/available Intending Bidders who have deposited EMD amount Through Demand Draft Nationalised Bank / RTGS / ONLINE Payment to participate in Auction sale for 16.02.2022 at 4.00 PM. (5) To the best of knowledge and information of the Authorized Officer, there is no encumbrance on the property under sale. However, the intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of property put on auction and claims/ rights/ dues/chain/ affecting the property, prior to submitting their bid. The Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of the Bank. The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to the Bank. The Authorized Officer/ Secured Creditor shall not be responsible in any way for any third party claims/ rights/ dues. (6) It shall be the responsibility of the bidders to inspect and satisfy themselves about the asset and specification before submitting the bid. The inspection of property put on auction will be permitted to interested bidders at sites on 10/02/2022 between 12.00 PM to 4.00 PM. (7) The Earnest Money Deposit (EMD) of the successful bidder/ highest bidder shall be retained towards part sale consideration and the EMD of unsuccessful bidders shall not be refunded. The Earnest Money Deposit shall not bear any interest. The sale shall be confirmed in favour of the purchaser who has offered the highest sale price in his bid or tender to the Authorised Officer and shall be subject to confirmation by the Secured Creditor. The highest bid will be subject to approval of the secured creditor/Authorised Officer. (8) The successful bidder shall have to deposit 25% of the sale price, (inclusive of EMD paid), on the same day or not later than next working day and the balance amount of purchase price payable i.e. 75% of the sale price will be paid to the Authorised Officer on or before 15th day of confirmation of sale by secured creditor. In case of default of payment within the period mentioned above all the amount deposited till then shall be forfeited including Earnest money and the defaulting purchaser shall forfeit all claim to the property or any part of the sum for which it may be subsequently sold. (9) The purchaser shall bear the applicable stamp duties/ additional stamp duty/ transfer charges, fee etc. and also all the statutory dues, taxes, rates, assessment charges, fees etc. owing to anybody. (10) The Authorised Officer is not bound to accept the highest offer and the Authorised Officer has the absolute right to accept or reject any or all offer(s) or adjourn/postpone/cancel the Auction without assigning any reason thereof (11) This is also a notice to the Borrower / Guarantor / Property owner of the aforesaid loan in respect of the sale of the above mentioned secured Asset under SARFAESI Act 2002 under Rule 8(6).

Place : Surat (Gujarat), Date : 31.01.2022 Authorised Officer, Cent Bank Home Finance Ltd.

Circle SASTRA Centre - 1st Floor, Meghani Tower, Station Road, Surat, Gujarat-3 Ph. : 0261-2454543 email: cs8323@pnb.co.in
POSSESSION NOTICE (For immovable property)

Whereas, the undersigned being the Authorised Officer of Punjab National Bank, SASTRA Centre, Surat under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 23/08/2021 served through paper publication in "Business Standard" and "Gujarat Mitra" dated 18/11/2021 under section 13(2) of the said Act calling upon the Borrower & Mortgagor M/s. Signora Texport Pvt., Ltd., Director, Guarantor & Mortgagor Manish Gupta, Director & Guarantor M. Luk Kumar and Smt. Sapna Sumi Kumar Agarwal Guarantor Smt. Archana Garg, Shri Pradeep V Mishra and Shri Virendra V Yadav, to repay the amount mentioned in the notice being Rs.8,86,80,965.41 (Rupees Eight Crore Eighty Six Lac Eighty Thousand Nine Hundred Sixty Five & Paise Forty One Only) as on 31/07/2021 with further interest w.e.f. 01/08/2021 at the contracted rate and cost expenses etc., until payment in full.

The borrowers attention is invited to provision of Sub Section (8) of the Section 13 of the Act in respect of time available to redeem the secured assets.

Description of Immovable Property(s)

1. All the plant & machinery installed at the factory premises purchased from Bank Finance, and stock lying at the factory premises.
 2. All that piece and parcel of the immovable industrial property being N.A. Land bearing Revenue Survey No. 74 land area 10300 sq. mtrs and Revenue Survey No. 79/7 land area 1100 sq. mtrs along with construction situated at Village Karajgam, within the Union Territory of Dadra & Nagar Haveli with all rights title. (Property owned by M/s. Signora Texport Pvt., Ltd.)
 Boundaries are as under:

	Revenue Survey No. 74	Revenue Survey No. 79/7
North	Survey No. 79/6, 79/7	Survey No. 79/6
South	Survey No. 73	Survey No. 74
East	Road	Road
West	Boundary vill. Of Udhwa (Maharashtra)	Survey No. 74

Date : 28/01/2022 Authorised Officer, Punjab National Bank, Place : Dadra & Nagar Haveli Circle SASTRA Centre, Surat

કિશન ભરવાડ હત્યા કેસમાં દાવત-એ-ઈસ્લામી સંગઠનની સંડોવણી ખુલી દિલ્હીથી ઝડપાયેલા મૌલાના કમર ગની ઉસ્માનીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

(પ્રતિનિધિ)અમદાવાદ,તા.૩૧
કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીથી ઝડપાયેલા મૌલાના કમર ગની ઉસ્માનીની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારો ખુલાસાઓ થયા છે. એટીએસની પૂછપરછમાં દાવત-એ-ઈસ્લામી સંગઠનની સંડોવણી ખુલી છે. મૌલાના કમર ગની ઉસ્માની આ સંગઠન સાથે જોડાયેલા છે. જેનું હેડક્વાર્ટર કરાચીમાં આવેલું છે. દાવત-એ-ઈસ્લામિક એન્થ્રોપોલોજી ઈન્સ્ટીટ્યૂટ યલાવે છે. જેની આડમાં યુવાનોનું ઓર્ગનિઝેશન કરીને હિંસક બનાવવામાં આવે છે. પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે, ૬ મહિનાથી કમર ગનીએ ગુજરાતના અલગ અલગ શહેરની મુલાકાત લીધી હતી. જેમાં ભારત વિરોધી એજન્ડા પર કામ કરી રહ્યો હતો. ત્રિપુરામાં થયેલી હિંસામાં પણ મૌલાના કમર ગનીની સંડોવણી ખુલી છે. મૌલાના કમર ગનીની અઘડબના કામદાર હેઠળ ધરપકડ પણ થઈ હતી. એટીએસ કમલેશ તિવારી હત્યા કેસમાં પણ મૌલાનાની પૂછપરછ કરી શકે છે. મૌલાના કમર ગની પાકિસ્તાનના

ફોન પર ઉશ્કેરણીજનક વાતો કરી ગાળાગાળી કરતા સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

(પ્રતિનિધિ) સાવલી,તા.૩૧
સાવલી નગરમાં મુસ્લિમોની ઠુઠ્ઠાનો ચાલુ છે તે બંધ કેમ નથી કરાવતા તેમ કહીને ઉશ્કેરણી કરીને બિભત્સ ગાળો બોલવાના પ્રકરણમાં સાવલી પોલીસ મથકે એક શબ્દ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાવલી પોલીસ મથકે કૃષ્ણલાલભાઈ વિરેન્દ્રભાઈ પટેલ રહે સહકર્તા પટેલ પકડી લાવ્યા હતા. તેમણે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધીને ચેતન દવે વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

કિશન ભરવાડની હત્યાની ઘટનામાં માત્ર રાજનીતિ નહીં પરંતુ નક્કર કાર્યવાહી થવી જોઈએ:અલ્પેશ ઠાકોર

(પ્રતિનિધિ)અમદાવાદ, તા.૩૧
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ આજે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ધંધુકા પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેમણે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી કિશન ભરવાડના પરિવારને સાંત્વના આપ્યા બાદ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હત્યાની ઘટનામાં માત્ર રાજનીતિ નહીં પરંતુ નક્કર કાર્યવાહી થવી જોઈએ. રાજ્યમાં આવા બીજા કોઈ યુવાન ન ગુમાવવા પડે તે માટે આયોજન થવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, આ ગુજરાતની શાંતિ તોડવાનો પ્રયાસ થયો છે. મૌલવીઓ પર બોલતા તેણે કહ્યું કે, નક્કર કાર્યવાહી મૌલવીઓને ધમકાવવામાં આવે તેમજ તેમની ગુજરાતની સ્થિતિ સુધારવામાં આવે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ગુજરાતમાં કટ્ટરવાદીઓનું કોઈ કામ નથી. જે લોકો ભાઈચારો તોડવાનો પ્રયાસ કરશે તેને જડબાતોડ જવાબ મળશે. તેમણે સોશિયલ મીડિયા પર સંચય બળવવાની અપીલ કરી હતી. ઉપરાંત તેમણે ફરિયાદો કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી હતી. ગુજરાતના યુવાનો, દીકરીઓ અને મહિલાઓ માટે હું તલવાર ઉઠાવવા પણ તૈયાર છું, એમ પણ તેમણે ઉમેર્યું હતું. કિશન ભરવાડના પરિવારને મળવા પહોંચેલા અલ્પેશ ઠાકોરે પરિવારને આર્થિક સહાય રૂપે કિશન ભરવાડની નાની દિકરીના હાથમાં એક લાખ રૂપિયાનું કવર આપ્યું હતું.

કિશન ભરવાડની હત્યા મામલે દિલ્હીના મૌલવી સહિત ૬ આરોપીના ૭ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

(પ્રતિનિધિ)અમદાવાદ,તા.૩૧
ધંધુકામાં ધોળા દિવસે કિશન ભરવાડ નામના યુવક ઉપર ફરિયાદ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાના મામલે દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માની સહિત ૬ જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓને આજે ગુજરાત એટીએસ દ્વારા ધંધુકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની વધુ પૂછપરછ માટે ૧૪ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેકેકે દ્વારા ૭મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસએ કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે કારણો આપતા એવી રજૂઆત કરી હતી કે, આરોપી અજીમને આ ગુનામાં વપરાયેલ વિસ્તોલ તથા પાંચ કરતૂતો મૌલાના અયુબ આચાર્યા હતા, જે વિસ્તોલ તથા પાંચ કરતૂતો તે કોની પાસેથી લાવ્યો? તથા તેણે બીજા કોઈ હથિયારો તથા કરતૂતો બીજા કોઈને આપેલા છે કે કેમ? તેની તપાસ કરવાની છે. આ ઉપરાંત આ ગુનાના કાવતરામાં પકડાયેલ આરોપીઓ સિવાય બીજા કોઈ વ્યક્તિઓ સીધી કે આડકતરી રીતે સંડોવાયેલી છે કે કેમ? તેમજ આરોપી અજીમને આ ગુનામાં પકડાયેલ આરોપીઓ મૌલાના અયુબ તથા સબ્બીરને કોઈ ફોન-કોલો ઉઠાવવા આપ્યો છે કે કેમ? અથવા કોઈ આર્થિક મદદ કરી છે કે કેમ? વળી, અજીમ અગાઉ આર્મ્સ એજન્ડાના ગુનામાં પકડાયેલો છે. જેથી તેણે બીજા કોઈ હથિયારોનો જથ્થો કે કરતૂતો સંતાડી રાખેલો છે કેમ? અજીમને આ ગુનામાં વપરાયેલ તથા કાબે થયેલા હથિયારો ઉપરથી અગાઉ અન્ય કોઈ ગુનામાં ક્યાં છે કે કેમ? આરોપી અજીમ રાજકોટના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં મદદ, મારમારી, આર્મ્સ એજન્ડા તથા પ્રોડીબીશનના ૧૦ થી ૧૨ જેટલા ગુનાઓમાં પકડાયો છે, તથા પાસા હેઠળ પણ અટકાયત થયેલી છે. જેથી તે ખૂબ જ રીકો ગુનેગાર હોવાથી ગુનામાં પ્રકાશ પાડે તેવી સાચી હકીકત જાણવતો નથી. એટીએસએ કોર્ટને એવી પણ રજૂઆત કરી હતી કે, આરોપી મૌલવી કમર ગની ઉસ્માની તહેરીક-એ-

શહેરી ગેસ વિતરણ ક્ષેત્રે અદાણી ટોટલ ગેસ આવતા ૮ વર્ષમાં ૨૦ હજાર કરોડનું રોકાણ કરશે

અમદાવાદ, તા.૩૧
શહેરી વસાહતોમાં ખાનગી ગેસ વિતરણના ક્ષેત્રની ટેરની મોટી અને અદાણી બુથ અને ટોટલ એનર્જી સાથેના સંયુક્ત સાહસની અદાણી ગેસ લિ.એ ૧૪ નવા ભૌગોલિક ક્ષેત્રોમાં તેના શહેરી ગેસ વિતરણ માટેના માળખાને વિસ્તારવા માટે તાજેતરમાં બિલ હાંસલ કરીને લાયસન્સ મેળવ્યા છે. પ્રેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના હમણાં જ સંમ્પન થયેલી ૧૧ રાઉન્ડની બિડીંગ પ્રક્રિયાના અંતે આ બિલ જીતી લીધી હતી. આમ હવે અદાણી ટોટલ ગેસ લિ. બાવન ભૌગોલિક ક્ષેત્રોના ઘરોને ઈથેન ગેસ પૂરો પાડવાની કંપની બની છે. આ પૈકીના ૧૯ વિસ્તારોમાં તે ઈન્ડિયન ઓઇલ કંપની સાથે વ્યુહાત્મક સંયુક્ત સાહસ ભાગીદારીમાં તે ગેસ વિતરણ કરે છે. ૩ કેન્દ્ર શાસિત પ્રદેશો અને ૧૮ રાજ્યોના ૧૧૮ બિજાઓમાં ફેલાયેલા બાવન વિસ્તારોમાં તેનો હિસ્સો ૧૫ ટકા છે. પર્યાવરણીય અનુકૂળ પાઈપ નેચરલ ગેસ (પીએનજી) અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ક્ષેત્રની એક અગ્રણી કંપની તરીકે પ્રસ્થાપિત થયેલી અદાણી ટોટલ ગેસ લિ.ને ૧૪ નવા ભૌગોલિક ક્ષેત્રોના પ્રાથમિક અધિકારો સાથે અમે અમારુ કદ ૩૯ થી ૯૫ બિજાઓમાં વિસ્તાર્યું છે. એમ અદાણી ટોટલ ગેસ લિ.ના સીઈઓ સુરેશ મંગલાણીએ જણાવ્યું છે. અદાણી સમૂહ અને ટોટલ એનર્જીના મજબૂત ટેકાથી આ તમામ નવા ૧૨ બિજાઓમાં ગેસ વિતરણના માળખાના વિકાસની ગતિવિધી ઝડપી બનાવવા અને કૃત નિશ્ચયી છીએ.

છોટાઉદેપુર અલીરાજપુર રોડ જર્જરિત હોઈ વાહનચાલકો અને રાહદારીઓ તંત્ર સામે ખફા

(પ્રતિનિધિ)છોટાઉદેપુર,તા.૩૧
છોટા ઉદેપુર-અલીરાજપુર ધોરીમાર્ગ પૈકી બોડેલિથિ ફેરફાર સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે આ રોડ જર્જરિત હોવાના કારણે આ માર્ગને આવડી લેતા તમામ ગામોના લોકો તથા વાહનચાલકોમાં સરકારના સંલગ્ન વિભાગો સામે પ્રબળ રોષ જોવા મળ્યો હતો. આજર્જરિત માર્ગને કારણે લોકોમાં રોષ નું કારણ પણ ચોચ હતું કારણકે અનેક વાહનોના નાના મોટા વાહનોને પાટર્સ નું નુકસાન થયા બાબતનું હતું. અને હજારોના વાહનોના પાટર્સનું નુકસાન થવાના કારણે અનેક વાહનોના ચાલકોએ જણાવ્યું હતું કે આર્થિક રીતે વાહનોના માલિકો પડી ભાંગ્યા છે ધંધો રોજગાર મંદ ચાલેલું ત્યારે અબજોના રોડ ટેક્ષ ભરતાં વાહન ચાલકોને રોડ પણ વ્યવસ્થિત મળતા નથી અને જેને કારણે વાહનોને ટેક્ષ ભરવાનું અને પાટર્સ ટુટી નુકસાન થાય છે જેનાથી તંત્ર સામે ટ્રક ઓનર્સ, ટ્રાન્સપોર્ટ માલિકોએ નારાજગી વ્યક્ત કરી સત્વરે રોડ બનાવવા માંગ કરી છે.

APAR APAR INDUSTRIES LIMITED
(CIN : L31100GJ1989PLC012802)
Registered Office : 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodara - 390 007 (Gujarat), India.
Tel. No. : (0265) 2339906 Fax : (0265) 2330309 E-mail : com.sec@apar.com URL : www.apar.com

EXTRACT OF UN-AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER AND NINE MONTHS ENDED 31st DECEMBER, 2021

Particulars	Consolidated		
	Quarter ended	Nine Months ended	Quarter ended
	31st Dec., 2021	31st Dec., 2021	31st Dec., 2020
	(Reviewed)	(Reviewed)	(Reviewed)
Total Income from operations (Gross)	2,228.83	6,307.54	1,713.98
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	73.87	230.05	105.73
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	73.87	230.05	105.73
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	54.90	174.07	82.45
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	69.95	228.77	69.95
Equity Share Capital	38.27	38.27	38.27
Earnings Per Share (Face Value of ₹ 10/- each) (for continuing and discontinued operations)			
Basic and Diluted	14.36	45.49	21.55

Notes:
1) The said Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Meeting held on 31st January, 2022.
2) Additional information on Standalone financial results is as follows:

Particulars	Consolidated		
	Quarter ended	Nine Months ended	Quarter ended
	31st Dec., 2021	31st Dec., 2021	31st Dec., 2020
	(Reviewed)	(Reviewed)	(Reviewed)
Total Income from operations (Gross)	2,071.31	5,775.04	1,583.91
Profit before tax	70.70	211.73	89.46
Profit for the period	52.87	157.54	66.73
Total Comprehensive Income (after tax)	67.96	210.74	54.38

3) The above is an extract of the detailed format of Statement of Standalone and consolidated financial results filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Statement of Standalone and consolidated financial results are available on the Stock Exchange websites www.bseindia.com (Scrip Code 532259) and www.nseindia.com (Scrip Symbol - APARINDS) and on Company's website www.apar.com.

For APAR Industries Limited
Sd/-
Kushal N. Desai
Chairman & Managing Director
DIN : 00008084

Place : Mumbai
Date : 31st January, 2022

(વડોદરા શહેરમાં..)
એલ.પી.જી./સી.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન એન્ડ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરિંગ સેવાઓ, પોર્ટ અને ફરીથર સર્વિસ, ખાનગી સિફ્ટફીલ્ડી સેવા, પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની ઘ્યા તથા સારવાર સંબંધિત સેવાઓ. કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા. ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ. આંતરરાજ્ય, આંતર બિજા અને આંતર શહેરોમાં વ્યાપાર / સેવાના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ. તમામ પ્રકારના ઉત્પાદન/ ઓથોગિક એક્સપો અને તેને રો-મટીરીયલ પૂરો પાડવા એક્સપો ચાલુ રહેશે અને તેમના સ્ટાક માટેની વાહન વ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન કોરોના સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન કોરોના સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ બાંધકામોનો ભંગ શિક્ષાને પાત્ર ગુનો છે.

VOLTAMP TRANSFORMERS LIMITED
CIN : L31100GJ1967PLC001437
Regd. Off. : Makarpura, Vadodara - 390014.
Email : voltamp@voltamptransformers.com Website: www.voltamptransformers.com
Phone : +91 265 2642011/12, 3041403/480 Fax : 2646774, 3041499

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31st DECEMBER, 2021

Sr. No.	Particulars	(Rs.in Lakhs)		
		Quarter ended 31/12/2021 (Unaudited)	Nine Months ended 31/12/2021 (Unaudited)	Quarter ended 31/12/2020 (Unaudited)
1	Total income from operations (net)	31495.14	74001.11	17574.98
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	3982.11	10112.69	4059.36
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	3982.11	10112.69	4059.36
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	3011.22	8097.49	3206.05
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and other Comprehensive Income (after tax))	2986.38	8021.85	3197.96
6	Paid up Equity Share Capital (face value of Rs.10 each)	1011.71	1011.71	1011.71
7	Reserves (excluding Revaluation Reserve)	---	---	---
8	Earnings Per Share (not annualised)			
	Basic:	29.77	80.04	31.68
	Diluted:	29.77	80.04	31.68

Notes:-
1. The above unaudited results for quarter and nine months ended 31st December 2021 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on Monday, 31st January 2022.
2. The above is an extract of the detailed format of Quarter / Nine Months ended 31st December 2021 Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and nine months ended Financial Results are available on the Company's website at www.voltamptransformers.com and on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com.

For and on behalf of Board of Directors
FOR VOLTAMP TRANSFORMERS LIMITED
KUNJAL L. PATEL
VICE CHAIRMAN & MANAGING DIRECTOR

Place : Vadodara
Date : 31st January, 2022

સૂક્ષ્મ ખાદ્ય પ્રશિક્ષણ ઉદ્યોગના વિકાસ માટે એક વિશેષ પહેલ

PMFME (માઈકો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝિસનું પ્રધાન મંત્રી ફોર્મલાઈઝેશન) સ્કીમ 3૫% સબસિડી સાથે બેંક લોન મેળવવા અને PMFME યોજના હેઠળ તમારા માઈકો ફૂડ એન્ટરપ્રાઇઝને વધારવા માટે અમારા પોર્ટલ www.pmfme.mofpi.gov.in પર ઓનલાઈન અરજી કરો.

યોજના હેઠળ ૨ લાખથી વધુ માઈકો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝને લાભ મળશે

PMFME યોજનાના લાભો

- ૩૫% બેંકમાંથી લોન લેવા પર ૩૫% સબસિડી મેળવો (મહત્તમ રૂ.૧૦ લાખ)
- બિજાના ODOP ઉત્પાદન હેઠળ નવા ઉદ્યોગો સ્થાપવા માટે બેંક તરફથી લોન અને સબસિડી પણ ઉપલબ્ધ છે
- તાલીમ અને ટેકનિકલ સપોર્ટ

બેંકમાંથી લોન અને ૩૫% સબસિડી મેળવવા માટે આજે જ www.pmfme.mofpi.gov.in પર અરજી કરો

www.pmfme.mofpi.gov.in | 01302281089

PMFME-Ministry-of-Food-Processing-Industries | Ministry of Food Processing Industries, India

વધુ જાણવા માટે હવે સ્કેન કરો